

**અરજદારની ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા કલમ ૫૦૩ મુજબની અરજી અન્વયે
આંક-૧ લગત હુકમ**

(૧) અરજદારની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિ. એ.પી.પી.શ્રીને સાંભળ્યા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

(૨) હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે, તેઓ અરજીમાં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ફ્રાઈમનો બનાવ બનેલ છે. અરજદારનાઓએ પોતાની અરજીમાં જણાવેલ કે સદરહુ બનાવમાં તેઓના બેન્ક ખાતાઓમાંથી કુલ રૂપિયા ૧૬,૯૯૯/- ઉપડી ગયેલ હતા અને તે બાબતે તેઓએ સાયબર પોર્ટલ ઉપર ફરીયાદ નોંધાવેલી હતી. અરજદારનાઓએ જણાવેલ કે સબબ સાયબર ફ્રાઈમ પોલીસ દ્વારા સામાવાળાના બેન્ક ખાતાઓમાંથી કુલ રૂપિયા ૯,૯૯૯/- બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા, જે હાલ સુધી સદર બેંકમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે, તેઓને ખુબ જ મોટુ આર્થિક નુકસાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય, સદર નાણા તેઓના ખાતામાં પરત અપાવવા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા કલમ ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

(૩) અરજદારની અરજી સબબ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.શ્રીએ તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. સદરહુ અભિપ્રાયમાં પી.આઈ.શ્રીએ જણાવેલ છે કે, સાયબર ફ્રાઈમનો ભોગ બનનારના નાણાં જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હોય છે, ત્યારે આવા નાણાંને તાત્કાલીક રોકવા તથા ગુના અટકાવવા

માટે ઈન્સ્ટેન્ટ રિસ્પોન્સ દ્વારા શંકાસ્પદ ખાતા ધારકનાઓને નોટીસ આપવામાં આવે છે અને નોટીસના આધારે શંકાસ્પદ રીતે મેળવેલ નાણાને ફીઝ કરવામાં આવે છે.

વધુમાં, પી.આઈ.શ્રીએ પોતાના અભિપ્રાયમાં જણાવેલ કે હાલના અરજદારનાઓ સાથે સાયબર ફ્રાઈમનો બનાવ બનેલ હતો જેમાં અરજદારના ઉપરોક્ત વિગતે રકમ ઉપડી ગયેલ હતી જે બાબતે તેઓએ સાયબર પોર્ટલ ઉપર ફરીયાદ નોંધાવેલી હતી. વધુમાં, પોલીસ અભિપ્રાયમાં જણાવવામાં આવેલ કે સામાવાળાના ઉપરોક્ત ખાતા શંકાસ્પદ હોવાનું જણાય આવે છે તથા સદરહું ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપીયા અરજદારશ્રીને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

(જ) સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેંક પેપર્સની નકલ ધ્યાને લેતા તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતા તે હકીકત સ્પષ્ટ થાય છે કે, હાલના અરજદારના બેંક ખાતામાં થી રકમ ઉપડી ગયેલ હતી, જે બાબતે તેઓએ સાયબર પોર્ટલ ઉપર ફરીયાદ નોંધાવેલી હતી. આમ, સદર હકીકત ધ્યાને લેતા અરજદારના ઉપર જણાવ્યા મુજબના ખાતામાંથી નાણાં ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદુપરાંત, રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતા હાલના કામે આજદિન સુધી કોઈ એફ.આઈ.આર. થયેલ હોય કે, હાલના કામે કોઈની ઘરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ આવતું નથી. વધુમાં, બનાવ બન્યે આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં, આજદિન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાંની અત્રેની અદાલત સમક્ષ માંગણી કરતી કોઈ અરજી કરેલ નથી. તદુપરાંત, તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતા તેઓ સમક્ષ પણ

કોઈએ આ નાણાંની માંગણી કરેલ હોય તેમ જણાતું નથી. તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેંક ખાતા શંકાસ્પદ હોવાનું જણાવેલું છે તથા સદરહું ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી. આમ, અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાંનો કબજો મેળવવા હકકદાર હોવાનું જણાય છે.

આ તબક્કે સદર નાણાં પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમત જોતા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૫૦૩ માં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે. ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૫૦૩ માં જણાવ્યા મુજબ જ્યારે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જપ્તીની જાણ મેજીસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય, ત્યારે મેજીસ્ટ્રેટને આવી મિલકતના નિકાલ અથવા તો કબજા બાબતે યોગ્ય લાગે તેવો હુકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે.

(૫) વળી, નામદાર ઉચ્ચતમ ન્યાયાલયના સુદરભાઈ અંબાલાલ દેશાઈ વિરુદ્ધ ગુજરાત રાજ્ય^૧ના ચુકાદામાં માનનીય ઉચ્ચતમ ન્યાયાલયે આ ઠરાવ્યુ કે,

“We hope and trust that the concerned Magistrate would take immediate action for seeing that powers under Section 451 Cr.P.C. are **properly and promptly exercised and articles are not kept for a long time at the police station**”.

1 AIR 2003 SC 638

વધુમાં, નોંધનીય છે કે સદરહુ રકમને બેન્કમાં ફીઝ રાખ્યેથી કોઈ હેતુ સિધ્ધ થતો હોય તેવું જણાય આવતું નથી. આ સિવાય, સદરહુ રકમ બેન્ક ખાતામાંથી અન્ય બેન્ક ખાતામાં જમા થયેલ હોય તેથી સદરહુ રકમની ઓળખ અંગેની તકરાર પણ ઉપસ્થિત થાય તેમ પણ નથી. આ સિવાય, એ પણ નોંધપાત્ર છે કે હાલની અરજી પર હુકમ થયેથી મુદામાલની માલિકી સાબિત થઈ જતી નથી પરંતુ કોર્ટ દ્વારા સદરહુ મુદામાલ વચગાળાની રાહે આપવામાં આવતા હોય છે. આમ, ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતા સદર નાણાં, ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય, ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: હુ ક મ ::-

- (એ) અરજદારની અરજી આથી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૫૦૩ હેઠળ આથી મંજૂર કરવામાં આવે છે.
- (બી) અરજદારને સદર ગુનાના કામે સીઝર કરવામાં આવેલ રોકડ રકમ રૂ. ૯,૯૯૯/- પુરાના દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલી જ રકમના સઘ્ધ ૨ જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી આ કેસના આખરી નિકાલ સુધી નીચેની શરતોને આધીન વચગાળાની કસ્ટડી સ્વરૂપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.
- (સી) વધુમાં, હુકમ કરવામાં આવે છે કે, અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તથા સઘ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેંકને કરવી તેમજ સદર બેન્કોને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી દ્વારા અરજદારે હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તેમજ સઘ્ધર

જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા સદર હુકમની જાણ મળેથી દિન-૧૦ માં તેમની બેન્કમાંના ખાતઓમા રકમ જમા છે, તે રકમ અરજદારના બેન્ક ખાતામાં જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો :-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે નાણાં અદાલત સમક્ષ રજુ કરવાના રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણાં પર કલેઈમ કરે અને પોતાનો હક્ક/હિત પુરવાર કરે અને તે સંદર્ભે ન્યાયી હુકમ પસાર થાય, તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત કરવાની રહેશે.
- (૩) સદર મુદામાલ રકમનો કોઈ ગુનાહિત કામે ઉપયોગ કરવો/કરાવવો નહીં.
- (૪) ઉપરોક્ત શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજરોજ તારીખ : ૧૧ મી, માહે: જુલાઈ, ૨૦૨૬ ના વાંચી સહી કરી ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો.

તા. ૧૧-૦૭-૨૦૨૬ જુનાગઢ	(કે.એ.મારવાહા) એડી. જ્યુડી. મેજી. ફ.ક. જજ, જુનાગઢ જજ કોડ જી.જે. ૦૧૫૫૮
--------------------------	---